



પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય

આણંદ કૃષિ યુનિવર્સિટી,

આણંદ- ૩૮૮૦૦૧



પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, આકૃયુ, આણંદ ખાતે આયોજીત

૫૨મી સ્નાતક બેચનો વિદાય સમારંભ

આણંદ કૃષિ યુનિવર્સિટી સંલગ્ન પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય દ્વારા ૫૨મી સ્નાતક બેચનો વિદાય સમારંભ તા. ૧૮/૦૭/૨૦૧૯નાં કપિલા સેમિનાર હોલ ખાતે આયોજીત થયેલ હતો. કાર્યક્રમનાં શુભારંભે મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટ્ય અને પ્રાર્થનાગીત તથા યુનિવર્સિટી પ્રેરણાગીત પછી ઈ/યા ડીનશ્રી ડો.એમ.એન. બ્રહ્મભટ્ટે મહાનુભાવોનું સ્વાગત પુષ્પગુચ્છ એવં ખાદી રૂમાલ તથા પુસ્તક આપી કરેલ હતું. તેમનાં સ્વાગત ઉદબોધનમાં તેમણે મહાવિદ્યાલય દ્વારા પ્રાપ્ત થયેલ શિક્ષણ, સંશોધન એવં વિસ્તરણની સિદ્ધિઓ વર્ણવી, વિદાયમાન થઈ રહેલ સ્નાતક વિદ્યાર્થીઓને પ્રાપ્ત કરેલ જ્ઞાન છેવાડાનાં ગ્રામ્ય પશુપાલકો સુધી પહોંચાડવા જણાવેલ હતું. પ્રમુખસ્થાને બિરાજેલ આણંદ કૃષિ યુનિવર્સિટીનાં માનનીય કુલપતિશ્રી ડો. એન.સી. પટેલ સાહેબે વિદાય થઈ રહેલ સ્નાતક બેચને અભિનંદન પાઠવી, પશુઓનાં સ્વાસ્થ્યની જાળવણી અને વૈજ્ઞાનિક ઢબે પશુપાલન થકી, પશુપાલકોનાં ઉત્કર્ષમાં સહભાગી થવા પ્રોત્સાહિત કરેલ હતાં. અતિથિ વિશેષ તરીકે પધારેલ આણંદ કૃષિ યુનિવર્સિટીનાં સંશોધન નિયામકશ્રી ડો. કે.બી. કથીરિયા સાહેબે અનુસ્નાતક અભ્યાસક્રમ વિશે બૃહદ માર્ગદર્શન આપી, અત્યાધુનિક ટેકનોલોજીનાં માધ્યમથી પોતાનાં શિક્ષણને પશુપાલકો સુધી પહોંચાડી પશુપાલન સમૃદ્ધિમાં ભાગીદાર થવા માટે હાકલ કરી હતી. અતિથિવિશેષશ્રી તરીકે પધારેલ આણંદ કૃષિ યુનિવર્સિટીનાં કાર્યકારી કુલસચિવશ્રી ડો. એમ.એમ. ત્રિવેદી એ વિદાયમાન વિદ્યાર્થીઓને પશુચિકિત્સક તરીકેની ફરજો એવં જવાબદારીઓ અંગે વિસ્તૃત છણાવટ કરી માર્ગદર્શન પૂરું પાડેલ હતું. મુખ્ય અતિથિ વિશેષશ્રી તરીકે પધારેલ મહાવિદ્યાલયનાં જ ભુતપૂર્વ સ્નાતક અને જનરલ મેનેજર, સાબરમતી આશ્રમ ગૌશાળા, બીડજનાં ડો. અમરીષ પટેલે વિદાયમાન થઈ રહેલ કુલ ૭૩ વિદ્યાર્થીઓને વ્યાવસાયિક શપથ લેવડાવી પોતાનાં પશુચિકિત્સક તરીકેનાં દેશ-વિદેશનાં બહોળા અનુભવો અને તેના થકી મેળવેલ જ્ઞાનનું વિદ્યાર્થીઓ સાથે રસપ્રદ ઢબે આદાન પ્રદાન કરેલ હતું. મહાનુભાવો દ્વારા વિદાય થઈ રહેલ વિદ્યાર્થીઓમાંથી કુ.નેહા શર્માને “બેસ્ટ ઇન્ટરની”નું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ હતું. વિદાયમાન થઈ રહેલ બેચનાં પ્રતિનિધિ તરીકે કુ. ભક્તિ યાવડા અને શ્રી યશ જોષી દ્વારા પોતાનાં પાંચ વર્ષનાં અભ્યાસકાળની સ્મૃતિઓ રજૂ કરેલ હતી. સમારંભનું સફળ સંચાલન ડો. પુર્ણિમા જાની, સહપ્રાધ્યાપક, પેથોલોજી વિભાગ દ્વારા કરવામાં આવેલ હતું. ડો. એન.ડી. હિરાણી, યુ.જી.ટી.સી. ચેરમેન અને સહપ્રાધ્યાપક પેરાસાયટોલોજી વિભાગ દ્વારા આભારવિધિ થયા પછી સમારંભની પૂર્ણાહુતિ રાષ્ટ્રગીત સાથે થયેલ હતી.



પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, આકૃયુ, આણંદ ખાતે આયોજીત
પરમી સ્નાતક બેચનો વિદાય સમારંભ